

# Mane Piyariyu Sambhare Song Lyrics

---

He aayo konudo mane piyariyu hambhare  
He e aayo kanudo mane piyariyu hambhare  
Nahi take pag maro sayabaji sasare  
He gokul aatham nu mane piyariyu sambhare  
Takato nathi pag maaro saybaji sasare

Ae nahi java dav tane aaj  
Kon kare ghar no komkaaj  
Nahi java dav tane aaj  
Kon kare ghar no komkaaj  
Hamana revado nathi javanu piyariye  
He hamana rahevado nathi javanu piyariye  
Aayo konudo tane piyariyu hambhare

Mari jethani e bhari kapada ni thelio  
Aayo konudo mane piyariyu hambhare

Maani thai che umar ne benaba gaya saasare  
Ghar nu koam padyu chhe tara re bharose

He nanad ba ne phone karo aavo beni malava  
Mare javu piyar ma kanudo re kudava

Be dada pela beni gai  
Ene pachhi bolavay nahi  
Be dada pela beni gai  
Ene pachhi bolavay nahi  
Jamai ne nokari hoy chhe vela re parodhiye  
He jamai ne nokari hoy chhe vela re parodhiye  
Samevala haga no vichhar thodo kariye

Tamare kanudano mahima ocho hoy se  
Mara banahkanthe mahima jaajo hoy se

Mane mara dhandhamathi time nathi malto  
Bharatlyrics.com  
Tame char dada vagar pachho nathi valato  
Ho mavatar nu modhu joye thaijya jaja mahina  
Unale gai hati chek bhai na re lagan ma

Tara javano vandho nathi koy  
 Badhu kamkaj kare kon oi  
 Javano vandho nathi koy  
 Badhu kamkaj kare kon oi  
 Maldhor ne kon chaar puro karashe  
 He maldhor ne kon chaar puro karashe  
 Be time doi kun dudh re bharavshe

Gom maa thi be chhar majur lai aavjo  
 Mari hatu thodi taklif lejo

He haru koi vodho nahi hachhvi lesu ame  
 Raaji thai konudo rami aavo tame  
 Parme pachho velo aavjo vali tame  
 Parme pachhi veli aavu re valamiya

More Lyrics from [Saregama Gujarati](http://Saregama Gujarati)

## મને પિયરચું સાંભરે Lyrics in Gujarati

હે આયો કોનુંડો મને પિયરચું હોભરે  
 હે એ આયો કોનુંડો મને પિયરચું હોભરે  
 નહિ ટક્રે પગ મારો સાચબાજી સાસરે  
 હે ગોકુળ આથમ નું મને પિયરચું હોભરે  
 ટકતો નથી પગ મારો સાચબાજી સાસરે

એ નહિ જવા દવ તને આજ  
 કોણ કરે ઘર નો કોમ કાજ  
 નહિ જવા દવ તને આજ  
 કોણ કરે ઘર નો કોમ કાજ  
 હમણાં રહેવાદો નથી જાવાનું પિયરિયે  
 હે હમણાં રહેવાદો નથી જાવાનું પિયરિયે  
 આયો કોનુંડો તને પિયરચું હોભરે

મારી જેઠાણી એ ભરી કપડો ની થેલીઓ  
 આયો કાનુડો મને પિયરચું હોભરે

માં ની થઇ છે ઉમર ને બેનબા ગયા સાસરે  
 ઘર નું કોમ પડ્યું છે તારા રે ભરોશે

હે નણંદ બા ને ફોન કરો આવે બેની મળવા  
 મારે જાવું પિયર મા કાનુડો રે કૂદવા

બે દાડા પેલા બેની ગઈ  
 એને પાછી બોલાવાય નહિ  
 બે દાડા પેલા બેની ગઈ  
 એને પાછી બોલાવાય નહિ  
 જમાઈ ને નોકરી હોય છે વેલા રે પરોઢિયે  
 ભારતલીરીકસ.કોમ  
 હે જમાઈ ને નોકરી હોય છે વેલા રે પરોઢિયે  
 હામેવાળા હુંગા નો વિચાર થોડો કરીયે

તમારે કાનુડાનો મહિમા ઓછો હોય સે  
 મારા બનાહકોઠે મહિમા જાજો હોય સે

મને મારા ઘંધામાંથી ટેમ નથી મળતો  
 તમે ચાર દાડા વગર પાછો નથી વળતો  
 હો માવતર નું મોઢું જોયે થઇ જ્યાં જાજો મહિના  
 ઉનાળે ગઇ હતી છેક ભઈ ના રે લગન માં

તારા જવાનો વાંધો નથી કોય  
 બધું કામકાજ કરે કોણ ઓઈ  
 જવાનો વાંધો નથી કોય  
 બધું કામકાજ કરે કોણ ઓઈ  
 માલદોર ને કોણ ચાર પૂરો કરશે  
 હે માલદોર ને કોણ ચાર પૂરો કરશે  
 બે ટાઈમ દોઈ કૂન દૂધ રે ભરાવશે

ગોમ માં થી બે ચાર મજુર લઇ આવજો  
 મારી હાટ્ટુ થોડી તકલીફ રે લેજો

હે હાસં કોઈ વોંધો નહિ હાયવી લેશુ અમે  
 રાજી થઇ કોનુંડો રમી આવો તમે  
 પરમે પાછો વેલો આવજો વાલી તમે  
 પરમે પાછી વેલી આવું રે વાલમિયા

More Lyrics from [Saregama Gujarati](https://bharatlyrics.com/mane-piyariyu-sambhare-lyrics/)